

## ગુજરાત દર્શન ભાગ-૮

1. કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ?- પમા ઝોનમાં
2. ' સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં ક્યાં આવેલ છે ?- ભાવનગર
3. ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન હુમલામાં અવસાન થયું હતું ?- બળવંતરાય મહેતા
4. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?- શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
5. ગિરનાર તળેટીમાં અશોક સિવાયબીજા ક્યા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે ?  
- રુદ્રદામા અને સ્કંદગુપ્ત
6. ભારતના કુળ ૫૦૨ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા ?- ૩૬૬
7. ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે ?- નરસિંહ મહેતા
8. ક્યા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ' કુમાર'ની શરૂઆત કરી હતી ?-  
રવિશંકર રાવળ
9. ગુજરાત સરકાર દ્વારા સને ૨૦૧૩નો તાનારીરી એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો ?- બેગમ પરવીન સુલતાના
10. ગુજરાતના ક્યા ક્રાંતિવીરને લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી ?-  
શ્યામજી કૃષ્ણવર્મા
11. અમીરગઢ તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે ?- બનાસકાંઠા
12. શબ્દસૃષ્ટિ કઈ સાહિત્યિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?- ગુજરાત સાહિત્ય અકાદમી
13. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું છે ?- લક્ષ્મી
14. મહાગુજરાતની લડતના નેતા કોણ હતા ?- ઇન્દુલાલ યાજ્ઞિક
15. ' કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક કોણ છે ?- નરેન્દ્રભાઈ મોદી

16. અભયઘાટ કોની સમાધી છે ?- મોરારજીભાઈ દેસાઈ
17. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન કયું છે ?- હરણફાળ
18. ગુજરાત સરકારે ' વહીવટીક્ષેત્ર ફરિયાદ નિવારણનો ઓનલાઈન' કાર્યક્રમ તે ક્યા નામે ઓળખાય છે ? - સ્વાગત
19. સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે ?- સાઈકલ
20. વડોદરા ખાતે આવેલ કડીપાણી ખાતે શાનું શુધ્ધિકરણનું કારખાનું આવેલું છે ? - ફ્લોર સ્પાર
21. આઝાદીના ક્યાં સત્યાગ્રહ પછી સરદાર વલ્લભભાઈ પટેલ ' સરદાર' તરીકે પ્રસિદ્ધ પામ્યા ?- બારડોલી સત્યાગ્રહ
22. ' તુલસીશ્યામ' સ્થળ ક્યા બે જીલ્લાની હદ પર આવેલી છે ?- અમરેલી અને જુનાગઢ
23. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આર્યુવેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી હતી ?- પાટણ (૧૯૨૩)
24. ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? - એચ.એમ.પટેલ
25. ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે ક્યા જીલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલ છે ? - જામનગર
26. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી રહી છે ?- સાધુ બેટ (૧૮૨ મિટર ઊંચાઈ)
27. ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ?- તાનસેન
28. પાકિસ્તાન સરકાર તરફથી ' નિશાને- પાકિસ્તાન' એવોર્ડ ક્યા ગુજરાતીને આપવામાં આવેલો છે ?- મોરારજીભાઈ દેસાઈ
29. કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે ?- રાજપુરા

30. ક્યા ગુજરાતી આગેવાનને મરણોત્તર ' ભારત રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?- ગુલઝારીલાલ નંદા
31. ગુજરાતમાં ક્યા જીલ્લામાં પોચણીનો ધોધ આવેલ છે ?- નર્મદા
32. રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ' માણસાઈના દીવા' કોણે લખ્યું છે ?- ઝવેરચંદ મેઘાણી
33. મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન ' મીરાં દાતાર' ક્યાં આવેલું છે ?- ઉનાવા
34. ગુજરાતી જાણીતા કેળવણીકાર ગીજુભાઈ બધેકા ગુજરાતના બાળકો માટે ક્યા નામથી ઓળખાય છે ?- મૂછાળી મા
35. વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પીંગ સ્ટેશન ક્યાં આવેલું છે ?- સરદાર સરોવર ખાતે
36. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું ?- વિદ્યાગૌરી નીલકંઠ
37. ' સેવા સેતુ' કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ક્યા જિલ્લામાંથી કર્યો હતો ?- ભૂજોડી (કચ્છ )
38. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હતી ?- હરકુંવર શેઠાણી
39. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?- સાત
40. સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે ?- નડીયાદ
41. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી ?- આચાર્ય બુદ્ધિસાગરજી
42. ગાંધીજીએ ક્યા શહેર ખાતે કાયમ માટે માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી હતી ?- મદુરાઈ
43. નરસિંહ મહેતાની પુત્રીનું નામ શું હતું ?- કુંવરબાઈ
44. પાલીતણાના જૈન મંદિરો ક્યા પર્વત પર આવેલા છે ?- શેત્રુંજય
45. ગુજરાતના ક્યા બંધને ' મેગા પ્રોજેક્ટ' તરીકે ગણવામાં આવે છે ?- ઉકાઈ
46. ગુજરાતી નવલકથા ' માનવીની ભવાઈ' ના લેખક કોણ છે ?- પન્નાલાલ પટેલ
47. વડોદરા કઈ નદીને કિનારે વસેલું શહેર છે - વિશ્વામિત્રી

48. ગુજરાત સરકારની વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કન્યાઓને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે ?- રૂ. ૨૦૦૦/-
49. સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી ? - ભોળાભાઈ પટેલ
50. ગુજરાત રાજ્ય દેશની કઈ દિશામાં આવેલું છે ? - પશ્ચિમ